

એ'તેકાફના ફરજાઈલ તથા મસાઈલ

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

## એ'તેકાફના ફરજાઈલ

**એ'તેકાફની વ્યાખ્યા :** એ'તેકાફની નિયતથી અલ્લાહની રજામંદી માટે મસ્ઝિદમાં રોકાવું અને એટેકાફ (રોકાણ કરવું) કહે છે. નિયત એટલે દિલથી નિશ્ચય. જબાનથી પણ આ પ્રમાણે "નિસ્મિલ્લાહિ દખલ્ટુ વાતૈહિ તવક્કલ્ટુ નવૈતુ સુન્નાતલુ એ'તેકાફ" કહે તો બેહતર છે. એના માટે મુસલમાનનું આકિલ હોવું તથા જનાબતથી (અને ઘરમાં એ'તેકાફ કરે તે સ્ત્રીએ હેઝ તથા નિફાસથી) પાક હોવું શર્ત છે. બાલિગ હોવું શર્ત નથી. બલ્કે નાભાલિગ જો તમીજ (સમજ) ધરાવતો હોય તો તેનો એ'તેકાફ પણ સહીંછ થશે. (આલમગીરી, ભાગ-૧, પેજ-૨૧૧)

### ★ જહનમ વચ્ચે ત્રણ ખાઈઓ ઊભી કરો ★

★ હદ્દીખમાં છે કે : જે શખ્સ અલ્લાહની રજામંદી માટે એક દિવસનો એટેકાફ કરે તો અલ્લાહ તથાલા તેની (એટેકાફ કરનારની) તથા જહનમની વચ્ચે ત્રણ ખાઈઓ આડી કરી દેશે જેનું અંતર આસ્માન તથા જમીનના અંતર જેટલું હશે. (હુર્રે મન્દૂર, ભાગ-૧, પેજ-૪૮૬)

### ★ થોડીવારના એ'તેકાફની ફરીલત ★

★ "જે શખ્સ મસ્ઝિદમાં મગરિબથી લઈને ઈશા સુધી "મોઅ૜તકિફ" રહે. નમાજ અને કુર્ચાન મજૂદની તિલાવત સિવાય વાતચીત ન કરે, તો અલ્લાહ તથાલા પર લાઝિમ

એ'તેકાફના ફરજાઈલ તથા મસાઈલ

છે તે પોતાના કરમથી તે એ'તેકાફ કરનારના માટે જન્તમાં મહેલ તૈયાર કરે." (કશ્ફુલ ગુમહ્સ)

### ★ દોઝખ વચ્ચે ૫૦૦ વરસનો ફાસલો ★

★ તેને હજાર રાતો જાગીને ઈબાદત (શબ બેદારી)નો સવાબ મળશે અને તેની તથા દોઝખ વચ્ચે ૫૦૦ વરસનો ફાસલો થશે. (તજકેરતુલ વાએજીન)

### ★ ૩૦૦ શહીદોનો સવાબ ! ★

★ રમઝાનમાં એક દિવસ એટેકાફ કરનારને ૩૦૦ શહીદોનો સવાબ મળશે. (તજકેરતુલ વાએજીન)

### ★ બે હજ્જ બે ઉમરાનો સવાબ ★

★ રમઝાનમાં ૧૦ દિવસ એટેકાફ કરે તે એવો છે જેણે બે હજ્જ અને બે ઉમરા કર્યા. (શોઅબુલ ઈમાન, ભાગ-૩, પેજ-૪૨૫)

★ હજીરત સૈયેદોના હસન બસરી عَلَيْهِ السَّلَامُ થી નકલ થયેલ છે કે "મોઅતકિફ" (એ'તેકાફ કરનાર)ને દરરોજ એક હજ્જનો સવાબ મળે છે. (હુર્રે મન્દૂર, ભાગ-૧, પેજ-૪૮૬)

### ★ પાછલા ગુનાહો માફ ! ★

★ જેણે ઈમાન સાથે સવાબ મેળવવાની નિયતે એ'તેકાફ કર્યો તેના સર્વ પાછલા ગુનાહો માફ કરી દેવામાં આવશે. (જમેઅ સગીર, પેજ-૫૧૬)

### ★ ૧૦૦૦ સાલની ઈભાદતનો સવાબ ★

★ રમઝાનમાં છેલ્લા ૧૦ દિવસ એટેકાફ કરનારને ૧૦૦૦

એ'તેકાફના ફગાઈલ તથા મસાઈલ એ'તેકાફના  
સાલની ઈબાદતનો સવાબ મળશે અને ક્યામતના દિવસે લું  
તેને રબ તથાલા અર્શના સાયામાં જગા આપશે.  
(સુખાનલ્લાહ!) (તજકેરતુલ વાયેજીન)

કેટલીક જગાએ એ'તેકાફ કરનાર ભાઈઓ મસ્ખલાની  
અણાનતાને કારણે ઉપરોક્ત ફીલિલો ગુમાવી બેસે છે કેમ કે  
એ'તેકાફ સહીહ થતો નથી માટે આ લેખનો ધ્યાનપૂર્વક અભ્યાસ  
કરો અને બની શકે તો રમઝાનના બરકતી મહીનામાં પૂરો  
મહીનો, નહીં તો દસ દિવસ એ નહીં તો એક દિવસ તો  
જરૂર એ'તેકાફમાં બેસશો.

## એ'તેકાફના મસાઈલ

### ★ ઓટેકાફના પ્રકાર ★

(૧) વાનિલ : મન્ત માની હોય કે કામ થશે તો એટેકાફ  
કરીશ. એના માટે રોજા શર્ત છે.

(૨) સુણતે મોઅક્કડા : ૨૦ મી રમઝાનના ગુરુબ  
આફતાબ પહેલાંથી શવાલનો ચાંદ દેખાતા સુધી (છેલ્લા ૮ કે  
૧૦ દિવસ) આ સુણતે મોઅક્કડા કિફાયા છે વસ્તીમાંથી  
સૌ છોડી હે તો સૌની પકડ થશે. અને એક મર્દ પણ કરી  
લેશો તો સૌ છૂટી જશો. એમાં પણ રોજા શર્ત છે પણ તે જ  
રમઝાનના પૂરતા છે. ગુરુબ આફતાબની અગાઉ મસ્ઝિદમાં  
એન્ટ્રી થઈ ગઈ ભલે ફનાએ મસ્ઝિદ જેમ કે વુગ્ઝુખાનુ કે જૂતા  
ઉતારવાની જગા સુધી ગયો અને ગુરુબ આફતાબ થઈ ગયો તો  
પણ એ'તેકાફ સહીહ ગણાશે. (હવાલો : ફ્યુજાને એ'તેકાફ)

03

એ'તેકાફના ફગાઈલ તથા મસાઈલ એ'તેકાફના  
(૩) નફલ ઓટેકાફ : એમાં રોજા શર્ત નથી, થોડી  
વારનો પણ થઈ શકે. મસ્ઝિદ બહાર નીકળો તો નફલ એટેકાફ  
ખત્મ થયો, ફરી દાખલ થાય તો નિયત કરી લે. મર્દ મસ્ઝિદમાં  
એટેકાફ કરે અને સત્રી ઘરમાં જે જગા નમાજ માટે મુકરર્ર કરે  
ત્યાં એટેકાફ કરે, તેને 'મસ્ઝિદે બેત' કહે છે.

### ★ મસ્ઝિદ વિશે સમજૂતી ★

મસ્ઝિદમાં અસ્લ મસ્ઝિદ સિવાયના ભાગને ખાર્જે  
મસ્ઝિદ અથવા ફનાએ મસ્ઝિદ (જમાઅતખાના સિવાયનો  
ભાગ) કહે છે. સામાન્યતઃ જમાઅતખાનુ અસ્લ મસ્ઝિદ તરીકે  
નિશ્ચિત હોય છે, જ્યાં એથી અધિક વિસ્તાર પણ અસ્લ મસ્ઝિદમાં  
સમાવ્યો હોય છે, તો તેની જાગ્રાકારી મેળવી લેવી જરૂરી છે જેથી  
"મસ્ઝિદના આદાબ" સાચવી શકાય. જો કે એ'તેકાફના કરનાર  
માટે "અસ્લ મસ્ઝિદ" તથા "ફનાએ મસ્ઝિદ" બંનેવ  
મસ્ઝિદના હુકમમાં છે. એટલે કે એ બંનેવમાં વિના સંકોચે  
જઈ શકે છે. જેનો ખુલાસો આગળ આવશે. (બેહતર એ છે કે  
વિના કારણે ફનાએ મસ્ઝિદમાં પણ મોઅતકિફ ન જવું જોઈએ.)

### ★ એ'તેકાફ દરમ્યાન બહાર નીકળવાના શબદો તથા સાવચેતીઓ ★

રમઝાનના છેલ્લા ૧૦ દિવસનો એટેકાફ કરનારને જે  
કામો માટે મસ્ઝિદની બહાર નીકળવાની રજા આપી તે આ  
પ્રમાણો છે : જાજરૂ, પેશાબ, વુજૂ તથા ફર્જ ગુસ્લ અને  
મજબૂરીની હાલતમાં ખાવા લાવવા તથા જો ત્યાં જુમ્મા તથા  
જમાઅત ન થતી હોય તો જુમ્મા તથા જમાઅત માટે મસ્ઝિદથી

04

બહાર નીકળી શકે છે. પણ જે મસ્તિષ્યમાં આ સગવડો હોય તે મસ્તિષ્યમાંથી એ'તેકાફ કરનારને બહાર નીકળવાની દ્વારા નથી. જો મસ્તિષ્યના દરવાજા બહાર બંને પગો નીકળી જશો તો એ'તેકાફ તૂટી જશો. (બહારે શરીઅત, ભાગ-૫, પેજ-૧૫૦)

- ★ બીમારપુર્સી કરવા કે જનાઝામાં શિર્કત કરવા જઈ શકશે નહીં. (અબુ દાઉદ, ભાગ-૨, પેજ-૩૩૪)
- ★ અમૃતક મસ્તિષ્યદોમાં વુજૂખાનુ, પેશાબખાનુ, જાજરુ, બાથરુમ વગેરે મસ્તિષ્યની બિલ્ડિંગ છોડીને બહાર (એટલે ફનાએ મસ્તિષ્યની બહાર) હોય છે જેથી એ સ્થળોએ હાજત વિના નથી જઈ શકતા.
- ★ જાજરુ, બાથરુમ, વુજૂખાનુ બહાર હોય તો મસ્તિષ્ય છોડીને જાજરુ જતી વેળા કે વુજૂ કે ગુસ્લ કરવા જતી વેળા આવતાં જતાં રસ્તામાં સલામ કે જરૂરી વાત ચાલુમાં કરી શકે છે, એ પ્રમાણે વુજૂ કરતી વેળા પણ જરૂરી વાત ચાલુમાં જ વુજૂ કરતાં કરતાં કરી શકશે પણ વાત માટે અથવા કોઈને કાંઈ સમજાવવા રોકાશે તો એટેકાફ તૂટી જશો.
- ★ મસ્તિષ્યથી બહાર જાજરુ કે વુજૂ-ગુસ્લ માટે આવતાં જતાં ઝડપથી ચાલવું જરૂરી નથી, જરૂરત પ્રમાણે ધીરેથી ચાલી શકે છે. કોઈ માર્ગમાં રોકવા ચાહે તો ચાલતાં ચાલતાં કહી દેવું કે હું એટેકાફમાં છું જેથી રોકાઈ શકતો નથી. જો એક પલ (ક્ષણ) પણ રોકાશે તો એટેકાફ તૂટી જશો.
- ★ મસ્તિષ્યમાં એટેકાફ કરનાર વિના જરૂરત હુન્યવી વાત ન કરે અને જે વાત કરે તે પણ ધીમેથી, શોરો ગુલ ન મચાવે,

અને એટેકાફ કરનારને પણ વિના જરૂરત હુન્યવી વાત કરવાની સખત મનાઈ છે.

★ એટેકાફ વગરનો માણસ તો હુન્યવી વાત મસ્તિષ્યમાં કરી જ નથી શકતો, એવું કરનારના ૪૦ સાલના અમલ બર્બાદ થઈ જાય છે.

★ મસ્તિષ્યમાં હસવું કથમાં અંધારું લાવે છે. હા ! જરૂરત પ્રમાણે સ્મિત કરી શકે છે.

★ એ'તેકાફ કરનારે બિલકુલ મૂંગા રહેવું એવી જે માન્યતા છે તે ગલત છે.

★ જો મસ્તિષ્યમાં જાજરુની વ્યવસ્થા ન હોય અને મસ્તિષ્ય બહાર બનેલ જાજરુમાં ગંદકી વગેરેના કારણે તથીઅત ગભરાતી હોય તો હાજત માટે ઘરે જવામાં કોઈ વાંધો નથી. હવે ઘરેથી વુજૂ પણ કરતા આવે તોય વાંધો નથી, પણ એ સિવાય એક પલ પણ રોકાઈ શકશે નહીં. નહીં તો એ'તેકાફ તૂટી જશો. (હાશિયા તહતાવી અલલ મરાકી, પેજ-૫૭૮)

★ મસ્તિષ્ય બહાર એક પગ અને બે હાથ માથા સાથે કાઢશે તો એ'તેકાફ ન તૂટશે પણ બંને પગ કાઢશે તો તૂટી જશો.

★ ખાવા, પાણી લાવી આપનાર કોઈ જ નથી તો મજબૂરન્ન મસ્તિષ્ય બહાર જઈ શકશે પણ લાવીને મસ્તિષ્યમાં જ ખાશે. (બહરુરાઈક, ભાગ-૨, પેજ-૩૦૩)

★ કપડાં, વાસણ વગેરે મસ્તિષ્યમાં છાંટાન ઉડે એ શરતે કોઈ મોટા વાસણમાં ધોઈ શકાશે.

★ મસ્તિષ્યમાં અન્ય ભાઈઓ મોઅ૜તકિફ હોય તો તેમના સંગાથના હક્કોનો દરેક રીતે લેહાજ રાખે. જેમ કે એક

સહાબી કોઈ પ્રસંગે હુઝૂર ﷺ ની સાથે હતા. આપ ﷺ એ બે મિસ્વાક કાપી, એક સીધી હતી અને બીજી વાંકી હતી. સરકાર ﷺ એ સીધી મિસ્વાક સાથી સહાબીને આપી અને વાંકી પોતાની પાસે રાખી. તેમણે અર્જ કરી, સરકાર ﷺ તમે સીધી મિસ્વાક જ રહેવા દેતે. ફર્માવ્યું, જે શખ્સ કોઈની સાથે એક ઘડીના માટે પણ સંગાથ પામે તો કિયામતમાં તે સોહબતના બારામાં પૂછવામાં આવશે કે તે સોહબતનો હક્ક અદા કર્યો કે વેડફી કાઢયો ? ઈમામ મુહમ્મદ ગિજાલી "કીમીયાએ સાચાદત" માં આ હદીષ હેઠળ જણાવે છે કે સોહબતના હક્કથી મુરાદ ઈધાર (ત્યાગની ભાવના) એટલે અન્ય માટે ભોગ આપવો છે, સારી ચીજ બીજા માટે કુર્બાન કરવી જોઈએ.

- ★ જે કોઈ પોતાના મુસલમાન ભાઈની હાજત પૂરી કરવા માટે કોણિશ, ભાગદોડ કરે તે તેના માટે ૧૦ સાલના એ'તેકાફથી પણ અફઝલ છે.
- ★ મસ્ઝિદમાં સગવડ ન હોવાને કારણે મસ્ઝિદ બહાર જો જીજરૂ કે પેશાબ માટે ગયા અને ત્યાં અંદર કોઈ પહેલેથી ગયું હોય તો મસ્ઝિદમાં પાછા આવીને રાહ જોવાની જરૂરત નથી, ત્યાં ઉભો રહીને રાહ જોઈ શકશો, હવે એ દરમ્યાન વાતચીત પણ કરી શકશો. પણ હાજત પૂરી કર્યા બાદ રોકાવું જાઈજ નથી. જો રોકાશો તો એ'તેકાફ તૂટી જશે.
- ★ મસ્ઝિદમાંથી બહાર નીકળ્યા અને વુજૂર, પેશાબ કે પાખાના કરવા જતાં રસ્તામાં દેવું (કરજ) માંગવાવાળાએ રોકી લીધો તો એ'તેકાફ તૂટી જશે. (આલમગીરી, ભાગ-૧, પેજ-૨૧૨)

- ★ મસ્ઝિદ બહારના વુજૂખાના પર દાંત મંજન કે ટૂથ પેસ્ટથી દાંત સાફ કરવા માટે જવાથી એ'તેકાફ તૂટી જાય છે.
- ★ વુજૂખાનામાં વુજૂર કરવા જાય તો પણ દંતમંજન કે ટૂથપેસ્ટથી દાંત સાફ કરી શકશો નહીં, હા ! વુજૂર માટે દાતણ (મિસ્વાક) કરી લો કે જે સુન્નત છે.
- ★ વુજૂખાના પર વુજૂર દરમ્યાન સાબુનો ઉપયોગ નથી કરી શકતા.
- ★ વુજૂર કર્યા પછી તરત જ મસ્ઝિદમાં દાખલ થઈ જાય, હા, વુજૂખાનેથી અટક્યા વિના ચાલતાં ચાલતાં જ ટુવાલ હાથ મોં પર ફેરવી પાણી લૂછે જેથી વુજૂર કરેલ પાણીનાં ટીપાં મસ્ઝિદની ફર્શ પર ન ટપકે.
- ★ હવે મસ્ઝિદમાં દાખલ થઈને ઈચ્છે તો શાંતિથી હાથ, મોં લૂછે. બની શકે તો વુજૂર પછીની થોડી તરી વુજૂના ભાગો પર રહેવા દે, એ સવાબ છે.
- ★ વુજૂર પછી વુજૂખાના પર જ ઉભા રહીને કલ્બઅએ શહાદત અને બીજી હુઆઓ પદવાની શરૂઆત કરવી નહીં, પરંતુ મસ્ઝિદમાં આવીને પઢે.
- ★ વુજૂખાના પર જતાં પહેલાં જ બાંધો ચંદ્રાવી લે અને ઘડિયાળ ઉતારી લે. જો ભૂલી જાય તો ત્યાં પણ તેમ કરી શકશો વાંધો નથી.
- ★ વુજૂર કરતાં કોઈ વસ્તુ દા.ત. દાતણ, રૂમાલ, ટોપી વગેરે પડી જાય તો હાથ લંબાવી ઉંઠાવી શકે છે, પરંતુ તેને ઘોવામાં સમય બરબાદ ન કરે.
- ★ વુજૂર કર્યા પછી વુજૂખાના પર માથામાં કે દાઢીમાં કાંસકી ન

કરે તથા ઘડિયાળ પણ મસ્ઝિદમાં આવીને પહેરે.

★ વુજૂ હોય છતાં ફરી વુજૂ માટે વુજૂખાના પર જવાથી એ'તેકાફ તૂટી જશે.

★ વુજૂ તૂટવાનો શક હોય તો વુજૂ માટે જવું નહીં, કારણ કે ફક્ત વહેમથી વુજૂ તૂટતું નથી. જો પાકી ખાત્રી થઈ જાય તો વુજૂ કરવા જઈ શકશે.

★ પાણી પીવા કે લેવા માટે બીજાની મદદ લેવી પણ જાતે વુજૂખાના પર જવું નહીં.

★ વુજૂખાનામાં વાસણ કે કપડાં ધોવા જશો તો એ'તેકાફ તૂટી જશે.

★ વુજૂખાના પર કોઈ વસ્તુ ભૂલી જાય તો બીજા પાસે મંગાવી લે (પોતે લેવા જવું નહીં).

★ જો મસ્ઝિદના વુજૂખાના પર પાણી ન હોય તો કોઈ વગર એ'તેકાફવાળા પાસે પાણી મંગાવે અથવા મસ્ઝિદની સૌથી નજીકની જગ્યા પર જઈને વુજૂ કરી શકે છે.

★ ખાવા શરૂ કરતાં પહેલાં અને પછી હાથ ધોવા, કોગળા કરવા વગેરે ભલે સુન્નત છે પરંતુ એ કામો માટે વુજૂખાના પર જવું નહીં. એટલા માટે જ વાસણ (ચલમચી કે મોટી ડોલ વગેરે)ની વ્યવસ્થા પહેલેથી રાખે, પરંતુ એ વાસણમાં હાથ ધોતાં કે કોગળા કરતાં પહેલાં એક પણ છાંટો મસ્ઝિદની સફ પર કે ફર્શ પર ન પડે તેની કાળજી રાખવી.

★ જો કપડાં નાપાક થઈ ગયાં અને બીજા કપડાં પણ નથી અને કોઈ મદદગાર પણ નથી તો મજબૂરી ખાતર નાપાકી દૂર કરવા વુજૂખાના પર જઈ શકે છે પણ મેલાં કપડાં ધોવા જઈ શકાય નહીં.

નોંધ : આ સર્વ હુકમો તે વુજૂખાના માટે છે જે મસ્ઝિદથી બહારના ભાગે હોય. મસ્ઝિદમાં વુજૂ ખાનુ હોય ત્યાં જવામાં વાંદો નથી. જેનો ખુલાસો આગળ આવશે.

★ ખાવા ખાતી વખતે પોતાનુ દસ્તખાન જરૂર પાંથરે. મસ્ઝિદની ફર્શ કે સફ મેલી થવી જોઈએ નહીં.

★ મસ્ઝિદની દિવાલો કે ગાલીયા, સફો વગેરે પર ચીકણા હાથ કદી ન લગાડો તથા નાક કે કાનનો મેલ, કચરો એના ઉપર ન લગાડો.

★ મસ્ઝિદની સફોના દોરા અને સાદીઓની સળીઓ તોડવા, ઉખેડવાથી બચો.

★ મસ્ઝિદમાં સવાલ કરનારને કદી પણ કોઈ રકમ વગેરે આપવું નહીં. કારણ કે મસ્ઝિદમાં પોતાના માટે સવાલ કરવો હરામ છે (સવાલ કરનાર ફકીર કે મુસાફરને મસ્ઝિદમાં આપવાની છૂટ નથી).

★ કપડાં બદલવા મસ્ઝિદ બહારના બાથરૂમમાં જઈ શકાશે નહીં. મસ્ઝિદના ખૂણામાં લુંગી બાંધીને કપડાં બદલી નાખવાં.

★ જો ફક્ત એક પગ મસ્ઝિદની બહાર નીકળે તો એ'તેકાફ તૂટો નથી તથા બંને હાથ માથા સાથે મસ્ઝિદની બહાર નીકળે તો કંઈ વાંદો નથી. (બહરુરાઈક, ભાગ-૨, પેજ-૩૦૩)

★ બેઘ્યાલી (અંજાણ)માં મસ્ઝિદ બહાર નીકળી ગયા અને યાદ આવતાં અંદર આવી ગયા તો પણ એ'તેકાફ તૂટી જશે. પણ તોડવાનો ગુનોહ નહીં થાય. (રદુલ મુહતાર, ભાગ-૩, પેજ-૪૩૮)

- ★ કોઈ એવી બીમારી લાગી ગઈ કે મસ્ઝિદથી નીકળ્યા વગર ઈલાજ થઈ શકે નહીં તો ઈલાજ માટે બહાર નીકળો તો પણ એ'તેકાફ તૂટી જશે, જો કે એ'તેકાફ તોડવાનો ગુનોહ નહીં થાય, પણ કઝા કરવાની જવાબદારી રહેશે. (રહુલ મુહુતાર, ભાગ-૩, પેજ-૪૩૮)
- ★ જો કોઈ "મોઅતકિફ"ને ઉંઘમાં ચાલવાની ટેવ હોય અને "મસ્ઝિદ" બહાર નીકળી જાય તો એ'તેકાફ તૂટી જશે. (ફ્યુઝાને એ'તેકાફ)
- ★ ખાવા, પીવા કે ચા-નાસ્તો મસ્ઝિદમાં જ કરવો.
- ★ મસ્ઝિદમાં કાચી ડુંગરી, મૂળો, લસણ વગેરે બદબુદાર વસ્તુ ખાવી નાજાઈજ છે (એ'તેકાફ વગરનાઓએ પણ જો આવી વસ્તુ ખાદી હોય તો બરાબર મૌં સાફ કરી મસ્ઝિદમાં આવવું.)
- ★ જો જાજરુ કે પેશાબખાનામાં ગયા પછી ખબર પડી કે પાણી નથી તો બીજાની મદદ લઈ શકો છો. એ'તેકાફ માટે બેઠેલો માણસ મદદ માટે જઈ શકતો નથી.
- ★ મસ્ઝિદમાં કે બહારના સ્થળે જો કોઈ એ'તેકાફ કરનારે હસ્તમૈથુન કર્યું અને વિર્ય નીકળ્યું તો રોજો અને એ'તેકાફ બંને તૂટી જશે.
- ★ મઆજલાહ ! કોઈની જીભથી કુઝી કલામ નીકળી ગયો તો એ'તેકાફ તૂટી જશે. હવે એ કુઝી કલામથી તૌબા કરે, કલમા શરીફ પઢે અને પત્નીવાળો હોય તો ફરી નિકાછ પણ કરે. હવે તૂટેલ એ'તેકાફની કઝા નથી, કેમ કે મુર્તદ થવાથી ઈસ્લામના સમયના સર્વ અમલો બેકાર થઈ જાય છે. (હર્રે મુહુતાર મય રહુલ મુહુતાર, ભાગ-૩, પેજ-૪૩૭)

- ★ એ'તેકાફ કરનારે મસ્ઝિદમાં દાઢીની ખત બનાવવી કે વાળ કઢાવવા કે માથા અને દાઢીમાં તેલ નાખવામાં વાંધો નથી (કપડું પાથરીને સાવધાનીથી કરે જેથી મસ્ઝિદની સફો ખરાબ ન થાય અને એની ઉપર વાળ ન પડે). (હવાલો : ફ્યુઝાને એ'તેકાફ)
- ★ એ'તેકાફ કરનાર જો વિદ્યાર્થી હોય અને પોતાના કોર્સની ચોપડીઓ વાંચવા ઈચ્છે તો વાંચી શકે છે (આ તો મુસ્લિમ દેશોમાં થઈ શકે જ્યાં ઈસ્લામિક કોર્સ ચાલે છે)
- ★ વર્તમાનપત્રો વાંચવાથી બચ્યો કે જેમાં જાનદારના ફોટા કે ફિલ્મી ફોટા હોય.
- ★ કોઈ બૂટ ચંપલ ચોર ચોરી કરીને ભાગ્યો તો એને પકડવા મસ્ઝિદની બહાર ગયા તો એ'તેકાફ તૂટી જશે.
- ★ જમાઅતના સમયે પેશાબખાનામાં ગયા અને પાછા આવ્યા ત્યારે આખી મસ્ઝિદ ભરાઈ ગઈ તો પણ મસ્ઝિદની બહાર ઉભા ન રહે, અંદર જગા કરે.
- ★ મસ્ઝિદ જો વધારે માળની હોય અને ઉપર જવાનો માર્ગ મસ્ઝિદમાંથી જ હોય તો ઉપર જવામાં વાંધો નથી પણ કામ વગર છત પર જવું મકરૂહ છે.
- ★ મસ્ઝિદની સાથે જ મજાર શરીફ હોય, દરવાજા બહાર નીકળવું ન પડે તેવો હોય તો ત્યાં જઈ શકશે, ફાતેહા પઢી શકશે.
- ★ જો મિનારાનો રસ્તો મસ્ઝિદની બહાર (બિલ્ડિંગ બહાર) હોય તો પણ અજાન આપવા માટે "મોઅતકિફ" જઈ શકે

છે, કેમ કે હવે એ મસ્ઝિદથી નીકળનું શરર્દ જરૂરતના કારણે છે. (ફ્યુઝાને એ'તેકાફ)

- ★ અક્ષમાતે જો મરિજદની છત પડી ગઈ અથવા કોઈ બણજબરીથી કાઢી મૂકે તો બીજી મસ્ઝિદમાં તરત જ મોખ્યતકિફ થઈ જાય. એ'તેકાફ સહીહ થશે.
- ★ મસ્ઝિદ બહારના બાથરૂમે ઠંડક માટે બાથરૂમમાં નહાવા જ્ઞે તો એ'તેકાફ તૂટી જ્ઞે. મસ્ઝિદમાં બાથરૂમની વ્યવસ્થા હોય તો પણ ફર્જ ગુરુલ સિવાય નહાવા ન જવું એ જ બેહતર છે.
- ★ પેશાબ કર્યા બાદ ટીપાં પડવાની ફરિયાદ હોય તો ફક્ત ઈસ્તિન્જો કરવા (પાક થવા માટે જો મસ્ઝિદમાં વ્યવસ્થા ન હોય તો) મસ્ઝિદની બહાર જર્દ શકે છે.
- ★ એ'તેકાફની હાલતમાં ખામોશીને ઈબાદત સમજીને ચુપકીદી સાધી રાખવી મકરૂહે તહરીમી (નાજાર્દી) છે, અને ચુપ રહેવું સવાબની વાત સમજીને ન હોય તો કાંઈ વાંધો નથી. અને બુરી વાતથી બચવા ચુપ રહેવું તો આ'લા દરજો ઘરાવે છે કેમ કે બુરી વાત બોલવી ગુનોહ છે. અને જે વાતોમાં ન સવાબ ન ગુનોહ એટલે કે મુખાહ વાત એ'તેકાફવાળા માટે મકરૂહ છે પણ જરૂરત પૂરતી રજા છે. વિના જરૂરત મસ્ઝિદમાં મુખાહ વાત નેકીઓને એવી રીતે ખાય જાય છે જેવી રીતે આગ લાકડીને ખાય છે. (દુર્મુખ્તાર, ભાગ-૩, પેજ-૧૪૪)
- ★ જ્યારે મુખાહ વાતની આ હાલત છે તો ગીબત, ચુગલી, બિભત્સ વાતોનો કેટલો ગુનોહ હશે ?!

## એ'તેકાફ સંબંધે અગત્યના ખુલાસાઓ

### ★ કોઈ ગલતફહુમી હોય તો દૂર કરી લો ! ★

"અસ્લ મસ્ઝિદ" જેમાં જમાઅતખાનુ હોય છે અથવા મસ્ઝિદ બનાવનાર થકી જે જગા નમાજ માટે ખાસ કરવામાં આવે તે, અને "ખારિજે મસ્ઝિદ" એટલે સહન તથા વુજૂખાનુ તથા મસ્ઝિદની પૂરી બિલ્ડિંગ જેને ઉફ્ આમમાં સામાન્યત: લોકો મસ્ઝિદ કહે છે. અસ્લ મસ્ઝિદ સિવાયના ભાગને "ફનાએ મસ્ઝિદ" (મસ્ઝિદથી જોડાયેલ વિસ્તાર) પણ કહે છે ત્યાં એ'તેકાફ કરનારને જવાની ઈજાગત છે. (જેથી આ કિતાબમાં જ્યાં મસ્ઝિદ શબ્દ આવ્યો છે તેનો અર્થ "અસ્લ મસ્ઝિદ" તથા "ફનાએ મસ્ઝિદ" બંનેવ સમજવું. તથા જાજર, બાથરૂમ, વુજૂખાના બાબતે ચેતવણીઓ છે તે પણ મસ્ઝિદના ક્ષેત્ર બહાર હોય તેવાં જાજર, બાથરૂમ તથા વુજૂખાના માટે સમજવું.)

### ★ ફનાએ મસ્ઝિદ (ખારિજે મસ્ઝિદ) ★

એટલે તે સ્થળો જે મસ્ઝિદની બિલ્ડિંગના અંદર સંકળાયેલ હોય જેને સામાન્ય બોલચાલમાં મસ્ઝિદ કહે છે અને મસ્ઝિદમાં જરૂરતના માટે હોય છે, જેમ કે મીનારો, વુજૂખાનુ, પેશાબ ખાનુ, જાજર, બાથરૂમ, ઈમામ મોઅગ્રિનના રૂમો વગેરે, પગરખાં, જોડાં ઉતારવાની જગ્યા સુધી વગેરે આ સ્થળો અમુક મામલાઓમાં મસ્ઝિદના હુકમમાં છે અને અમુક મામલામાં ખારિજે મસ્ઝિદ છે. દા.ત. અહીં જુનૂબી એટલે

જેના પર ગુસ્લ ફર્જ હોય તે જઈ શકે છે. એ પ્રમાણે ઈકતેદા અને એ'તેકાફના મામલામાં આ સ્થળો મસ્જિદના હુકમમાં છે. એ'તેકાફ કરનાર જરૂરત વિના પણ ત્યાં જઈ શકે છે એ રીતે કે જાણો તે મસ્જિદના જ કોઈ હિસ્સામાં છે.

### ★ મોઅતકિફ (એ'તેકાફ કરનાર)

#### ફનાએ મસ્જિદમાં જઈ શકે છે ★

હજરત સદ્રુશશરીઅહ્ હજરત અલ્લામા અમજદ અલી ખાં "બહારે શરીઅત" ના લેખક ફર્માવે છે :—

"ફનાએ મસ્જિદ એટલે જે જગા મસ્જિદથી બહાર એનાથી જોડાયેલી (સંકલિત) મસ્જિદની જરૂરિયાત માટે હોય છે, દા.ત. જોડા કાઢવાની જગા અને બાથરૂમ વગેરે એમાં જવાથી એ'તેકાફ તૂટશે નહીં."

આગળ લખે છે :— "ફનાએ મસ્જિદ આ મામલામાં મસ્જિદના હુકમમાં છે." (ફતાવા અમજાહિયા, ભાગ—૧, પેજ—૩૮૮)

મસ્જિદનો મીનારો પણ મસ્જિદ છે તેનો દરવાજો મસ્જિદની બાઉન્ડરીમાં હોય તો એ'તેકાફ કરનાર વિના સંકોચે જઈ શકે છે અને જો દરવાજો મસ્જિદ બહાર હોય તો કેવળ અજાન આપવા માટે જઈ શકે છે કે અજાન આપવી એ શરીર જરૂરત છે. (હવાલો : ફયુજાને એ'તેકાફ)

#### ★ આ સંબંધે આ'લા દર્શનનો ફત્વો ★

એના જ અનુસંધાનમાં આ'લા હજરત, મુજદિદે દીનો મિલલત, શૈખુલ ઈસ્લામ વલુ મુસ્લિમીન ઈમામ અહમદ રગા મુહદિષ બરેલ્વી હા (عَلَيْهِ السَّلَامُ وَالرَّحْمَةُ وَالرَّحِيمُ)

".....બલ્કે જ્યારે તે મદ્રસા મસ્જિદની હદ્દોથી સાંકળેલા મસ્જિદની અંદર છે, તેમની વર્ચે માર્ગ આડો નથી (જે એ મદ્રસાઓને મસ્જિદની ચાર દિવારીથી અલગ કરી દે પણ) કેવળ એક દીવાલથી સહેનોનો વિભાગ અલગ કરી દેવાયો છે તો એમાં જવું મસ્જિદથી બહાર જવું છે જ નથી, એટલે સુધી કે એવી જગાએ મોઅતકિફ જવું જાઈ છે કે જાણે તે મસ્જિદનો એક ભાગ છે.

રહુલ મુહ્તારમાં બદાએઉસનાએઅના હવાલાથી છે :— જો એ'તેકાફ કરનાર મીનારા પર ચઢ્યો તો કશાય મતભેદ વિના તેનો એ'તેકાફ તૂટશે નહીં, કેમ કે મિનારો (એ'તેકાફ કરનાર) માટે મસ્જિદ (ના હુકમ) માં જ છે." (ફતાવા રજવિયથ્થ, ભાગ—૩, પેજ—૪૭૪)

ઉપરોક્ત લખાણથી ઘણી જ સ્પષ્ટતા સાથે એ'તેકાફ કરનાર માટે ઘણી સહૃદાતો જાણવા મળી છે. સહન મસ્જિદનો હિસ્સો છે જેથી એ'તેકાફ કરનારને મસ્જિદની સહનમાં આવવું, જવું, બેસી રહેવું કશીય પાબંદી વિના જઈ છે. યાદ રાખશો કે શરીઅતના હુકમ થકી આ સહૃદાતો મહાન ઉલમાની કિતાબોમાં દર્શાવવામાં આવેલી છે તો પછી અન્ય કોઈ વ્યક્તિ પોતાના તરફથી કોઈ પાબંદી લગાડી શકશે નહીં. હા ! જ્યાં વુગ્ઝ ગુસ્લ કે જાજ માટે તથા કોઈ જમવાનું લાવી આપનાર ન હોય તો તેને લેવા માટે એ'તેકાફ કરનાર મસ્જિદના મુખ્ય દરવાજાની બહાર નીકળો ત્યારે તે સર્વ હુકમો એ'તેકાફ તૂટવા વિશે દર્શાવ્યા તે લાગુ થશે, બાકી એવી મસ્જિદ જેમાં જાજ, બાથરૂમ, વુગ્ઝખાનું વગેરે અંદર જ છે તેના માટે એ હુકમો લાગુ થશે નહીં.

અંતમાં એક અધિક પ્રશ્ન બાબતે ફકીહે મિલ્લત મુફ્તી જલાલુદીન અમજદી عليه السلام નો જવાબ પણ જોઈ લો ! :-

### ★ એ'તેકાફ કરનાર બીડી પીવા ફનાઅ મસ્જિદમાં જઈ શકે છે ? ★

**સવાલ :** એ'તેકાફ કરનાર (મોઅતકિફ) જો બીડી, સિગરેટ, હુક્કો પીવાનો આદી (આદતવાળો) હોય તો શું કરે ? શું બીડી, સિગરેટ, હુક્કો વગેરે પીવા માટે મસ્જિદથી બહાર નીકળી જાય ? એવા સંજોગોમાં એ'તેકાફ બાકી રહેશે ? દલીલો સાથે જવાબ બયાન ફર્માવશો.

**જવાબ :** એ'તેકાફ કરનાર બીડી, સિગરેટ અથવા હુક્કો પીવાના માટે "ફનાઅ મસ્જિદ" માં નીકળી શકે છે, એ'તેકાફ તૂટશે નહીં. હઝરત સદરુશશરીઅહ્�દ عليه السلام લખે છે : ફનાઅ મસ્જિદ એટલે જે જગ્ગા મસ્જિદથી બહાર મસ્જિદથી જોડાયેલી મસ્જિદની જરૂરિયાત માટે છે, દા.ત. જોડા ઉતારવાની જગ્ગા અને ગુરુત્વાનું વગેરે એમાં જવાથી એ'તેકાફ તૂટશે નહીં. (ફિતાવા અમજદિયા, ભાગ-૧, પેજ-૩૮૮)

પરંતુ ખૂબ જ મોઢું સાફ કરીને બાદમાં (અસલ) મસ્જિદમાં દાખલ થાય એટલા માટે કે બીડી અને સિગરેટ વગેરેની ગંધ જ્યાં સુધી બાકી હોય ત્યાં સુધી મસ્જિદમાં પ્રવેશવું જાઈ નથી. વહુવ અભ્યાસ.

**લખનાર :** (મુફ્તી) જલાલુદીન અહમદ અમજદી, ૧૭-ગુલ કાયદા, હિ.સ. ૧૪૦૨ (ફિતાવા ફય્યારુર્સ્લા, ભાગ-૧, પેજ-૫૩૫)

### મુસ્લિમ બહેનોનો એ'તેકાફ

ઉમ્મુલ મુ'મિનીન હજરત આઈશા સિદ્દીકા عليه السلام ફર્માવે છે કે, "તાજદારે મદીના عليه السلام રમાનુલ મુબારકના છેવટના ૧૦ દિવસોનો એ'તેકાફ કરતા હતા, ત્યાં સુધી કે અલ્લાહ હું عليه السلام એ આપ عليه السلام ને વર્ફાત અતા ફર્માવી. પછી આપ રસી લ્લહ તુલ્લી અને પાક عليه السلام બીવીઓ ની પાક عليه السلام ના બાદ આપ عليه السلام એ'તેકાફ કરતી હતી." (સહીહ બુખારી, ભાગ-૨, પેજ-૩૧૪)

આ પરથી જણાયું કે આપણી માં બહેનોએ પણ એ'તેકાફ કરવાનું સદ્દ્ભાગ્ય હાંસલ કરવું જોઈએ.

★ બહેનો મસ્જિદમાં એ'તેકાફ નથી કરી શકતી, બદકે "મસ્જિદ બૈત" એટલે ઘરમાંની તે જગ્ગા જે નમાઝ માટે ખાસ કરી લે છે ત્યાં એ'તેકાફ કરે. (હુર્રે મુહ્તાર, રદુલ મુહ્તાર, ભાગ-૩, પેજ-૪૨૮)

★ કોઈ અન્યના ઘરે જઈને એ'તેકાફ નથી કરી શકતી.

★ પતિની રજા વિના પત્નીએ એ'તેકાફ કરવો જાઈ નથી. (રદુલ મુહ્તાર, ભાગ-૩, પેજ-૪૨૮)

★ જો પત્નીએ પતિની રજા લઈને એ'તેકાફ શરૂ કરી આપ્યો, બાદમાં પતિ મના કરવા ચાહે તો હવે મના નથી કરી શકતો. અને મના પણ કરે તો પત્નીના માથે તેનું પાલન વાજિબ નથી. (આલમગીરી, ભાગ-૧, પેજ-૨૧૧)

★ બહેનો માટે એ'તેકાફ કરવામાં એ પણ જરૂરી છે કે તેણી ડેઝ તથા નિફાસથી પાક હોય. કેમ કે એ દિવસોમાં નમાઝ, રોજા તથા તિલાવતે કુર્ચાન હરામ છે. (સર્વ કિતાબો)

- ★ સ્ત્રીને એ'તેકાફ દરમ્યાન માસિક શરૂ થયું તો વાજિબ છે કે લું તુરત જ એ'તેકાફ છોડી આપે. આ સંજોગોમાં જે દિવસનો એ'તેકાફ તૂટ્યો કેવળ તે જ દિવસની કાજા તેના જિભ્મે રહેશે. જેનો તરીકો એ છે કે માસિકથી પાક થયા બાદ કોઈ દિવસે રોજો રાખીને એ'તેકાફ કરી લે. જો રમજાન મુખારકમાં જ પાક થઈ જાય તો રમજાનમાં પણ કાજા કરી શકે છે. પણ જો પાક થતા સુધીમાં રમજાન પૂરી થઈ જાય તો રમજાન બાદ કોઈ દિવસે ખાસ એ'તેકાફ માટે જ રોજો રાખીને એક દિવસના એ'તેકાફની કાજા કરી લે.
- ★ તેણી માટે શરઈ જરૂરત વિના એ'તેકાફની જગાએથી નીકળવું જાઈજ નથી. ત્યાંથી ઉઠીને ઘરના કોઈ અન્ય ભાગમાં પણ નથી જઈ શકતી. જો જશે તો એ'તેકાફ તૂટી જશે.
- ★ બહેનો માટે એ'તેકાફની જગાએથી હટવા માટે તે જ હુકમો લાગુ થશે જે પુરુષને મસ્ઝિદ બહાર નીકળવા માટે જગ્યાવેલ છે. તેણી જેનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લે.
- ★ બહેનો એ'તેકાફ દરમ્યાન પોતાની જગાએ બેઠી બેઠી સીવવા પરોવવાનું કામ કરી શકે છે. ઘરનાં કામો માટે બીજાં માણસોને સૂચનો કરી શકે છે પણ જાતે ઉઠીને નથી જઈ શકતી.
- ★ બેહતર એ છે કે એ'તેકાફ દરમ્યાન સંપૂર્ણ ધ્યાન તિલાવત, જિક, હુરુદ, તરબીહાત, દીની કિતાબો તરફ આપે અને અકીદા વિશે તથા અન્ય મસ્ખલા મસાઈલના તેમજ ઈસ્લામી નેક ખાતૂનોના જીવનના અભ્યાસ તરફ ખાસ ધ્યાન રાખે.

## ★ એ'તેકાફ કાજા કરવાનો તરીકો ★

જો કોઈ કારણસર રમજાનના છેલ્લા ૧૦ દિવસનો એ'તેકાફ તૂટી ગયો તો ૧૦ (દસ) દિવસની કાજા જરૂરી નથી. તમારા માટે કેવળ તે એક દિવસની જ કાજા છે જે દિવસે એ'તેકાફ તૂટી ગયો. જો રમજાન શરીફના દિવસો હજી બાકી હોય તો કોઈ દિવસે સુખ્ષે સાદિકથી પહેલાં એ'તેકાફની નિયતથી આગલા દિવસના ગુરુબ આફતાબ (સૂર્યાસ્ત) થતા સુધી "મોઅતકિફ" રહે. રમજાન શરીફનો રોજો એ એ'તેકાફની કાજા માટે પૂરતો છે. જો રમજાન પછી કરે તો એ જ પ્રમાણે રોજો રાખીને એ'તેકાફ કરી લે. પણ ઈદુલ ફિત્ર તથા જીલ હજજના ૧૦ થી ૧૩ સિવાયના દિવસે કરે કેમ કે આ પાંચ દિવસોમાં રોજો રાખવો હરામ છે.

## ★ એ'તેકાફનો ફિદિયો ★

- ★ જો કાજા કરવાનો સમય મળ્યો છતાં કાજા ન કરી અને મૌતનો સમય નજીક આવી ગયો તો વારસોને વસિયત કરવી વાજિબ છે કે તેઓ આ એ'તેકાફના બદલામાં ફિદિયો અદા કરે અને ફિદયો અદા કરવો બહુ ભારી નથી. એ'તેકાફના ફિદયાની નિયતે કોઈ ઝકાતના હક્કદારને સદકાએ ફિત્રની જેટલા ઘઉં અથવા તેટલી કિંમતની રકમ અદા કરી આપે.
- ★ જો એ'તેકાફ કોઈ મજબૂરીના કારણે તોડ્યો હતો કે ભૂલથી તૂટ્યો હતો તો ગુનોહ નથી પણ જો જાણીબુઝીને કોઈ સહીહ મજબૂરી વિના તોડ્યો હતો તો એ ગુનોહ છે, જેથી કાજાની સાથે સાથે તૌબા પણ કરે.

## એ'તેકાફમાં બેસો ને પુષ્ટળ નેકી કમાયો !

પોતાના દુનિયવી લાભ માટે રહાનિયતને માનવાનો દાવેદાર માનવી જરૂર પડતાં બુજુગ્ઝોના મજારો પર પહોંચીને ખૂબ હુઆઓ કરે છે. મન્ત્રો માને છે, ચાદરો ચઢાવે છે..... બેશક ! એ બહુ સારી વાત છે કે અલ્લાહવાળાઓથી મહોભેતની નિશાની છે. પણ બહું જ ઓછા લોકો છે જેઓ આખેરતની જિંદગી સંવારવા કાંઈક માંગતા હોય છે. અને રૂહાનિયતના મુખ્ય સેન્ટર જ્યાંથી દરેક પ્રકારની દૌલત જ વહેંચાઈ રહી છે તે આપણા સૌથી ઘારા સૌથી આ'લા નબી કરીમ પાલિ ના રૂહાનિયતથી ભરપૂર ફર્માનોમાંથી લાભ મેળવવા પ્રતિ બહું જ જુઝ લોકો ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે !

દુનિયવી મતલબ માટે રૂહાની બુજુગ્ઝો પાછળ પડનારા લોકો જ્યારે દીન તથા આખેરત માટે કાંઈ કરવાનું કહેવામાં આવે છે તો ન બુજુગ્ઝોની વાતો પ્રતિ લક્ષ આપે છે ન પોતાના નબી પાલિ ના ફર્માનો પર અમલ કરે છે ! (ઈલ્લા માશાઅલ્લાહ !) આખેરતની મહાન મહાન ને અમતોના વાયદાઓ ખૂદ સરકાર પાલિ નેક અમલો કરનારને માટે સંભળાવે છીતાં નર્યા ભૌતિકવાદી હોય તેમ તેમના પર કોઈ અસર જોવા મળતી નથી ! અને દુનિયામાં ચૂર પ્રચૂર, દુનિયવી ગણિતો માંડવામાં મશગૂલ જોવા મળે છે. (ઈલ્લા માશાઅલ્લાહ !)

ઘાર દીની ભાઈઓ ! રમઝાન મુખારકનો મહીનો ! બરકતોનો મહીનો ! રહમતોનો મહીનો ! મગફિરતનો મહીનો ! નેકીઓના ઘોઘમાર વરસાદનો મહીનો ! જેમાં એક નેકી કરો ને ૭૦ નેકીનો બદલો પામો, નફ્લ અદા કરો ને ફર્જનો સવાલ પામો, જેમાં રોજુમાં વિશાળતા કરી દેવામાં આવે છે, શૈતાનને કૈદ કરી લેવામાં આવે છે, જન્મતને શણગારવામાં આવે છે, તેના દરવાજ ખોલી દેવામાં આવે છે, જહીનમના દરવાજ બંધ કરી દેવામાં આવે છે, તેમાં એક રાત હજાર રાતોથી અફજલ તે શાલેકડ છે.

અનુસંધાન ટાઈટલ નં. 3 પર....

**અનુસંધાન ટાઈટલ નં. 2 પર....**

અગણિત ફ્રીલાન્ડોવાળો આ મહીનો આવે છે. એમાં પણ કેટલાય લોકો એવા છે જેઓ ન રોજા રાખે છે ન કાંઈ તેમની રોજનીશીમાં ફરક આવે છે, ન ટી.વી.નો શૈતાની દરવાજે રમઝાન પૂરતો પણ બંધ થાય છે, ન ફ્રામા, સીરીયલો તથા પર સ્ત્રી પુરુષોના મિલના પોગામો જોવાનું બંધ થાય છે. જો આ જ આપણી હાલત હોય તો કચાંથી ભલાઈ મળી શકે ?!

મુસ્લિમાનો ! રહાનિયત પર વિભાસ તો એનું નામ છે કે તમે આખેરતના લાભો પ્રતિ દોડો ! અને અગાબોથી દૂર ભાગો ! પ્રસ્તુત કિતાબ રમઝાનના "એ'તેકાફ" સંબંધે સ્પષ્ટતાપણે ફરજાઈલ તથા મસાઈલ દર્શાવી રહી છે તેનો શાંતિથી અભ્યાસ કરો. અને અનુકૂળતા હોય તો ચોક્કસ ૧ મહીના માટે અથવા ૧૦ દિવસ માટે એ ન બને તો ૧ દિવસ તો એ'તેકાફ જરૂરથી કરો. અને મસ્ઝિદમાં રહીને ખૂબ જ ખુલ્લૂસથી અલ્લાહની ઈબાદત કરો. તમારો વધુને વધુ સમય જિંક, હુરુદ, તિલાવતે કુર્ચાન અને ખાસ તો અકીદા વિશે, નમાઝ, રોજા તથા અન્ય જીવન જરૂરી મસાઈલ શીખવા પાછળ, સુન્તો વિશે અભ્યાસ કરી તેના પર અમલ કરવા પાછળ પસાર કરશો. જેને એ'તેકાફમાં બેસવાની નેકબણ્ઠી મળી જાય અને જે બંદો ફક્ત રખને રાજી કરવા મસ્ઝિદમાં રોકાય રહે તેના નસીબનું શું કહેવું ?! માટે જિંક, હુરુદ, તિલાવત સાથે સાથે ઈલ્મ દીનની કિતાબોનો ખૂબ જ અભ્યાસ કરશો, કેમ કે ઈલ્મ હશે તો જ ઈબાદતો, તિલાવત વગેરે સહીહ થશે અને ઈમાન મજબૂત રહેશે, ઈશ્કે નબી પાલિ માં વધારો થશે અને ગુમરાહોને ઓળખી ગુમરાહીથી બચી શકશો.

ખબરદાર ! ખબરદાર ! એ'તેકાફમાં હોઉ કે ન હોઉ મસ્ઝિદમાં આવી ફોગટની વાતચીત કરવામાં સમય ન બગાડશો, કરેલી નેકીઓ ન ગુમાવશો, પણ નેકીઓ કમાઈને આખેરતને આખાઈ કરશો અને સુની મુસ્લિમો માટે હુાં ગુજારશો. -લિ. સંપાદક



મસ્લા મસ્લા આ'લા હિન્દુતના તર્જુમાન મસ્લા

**બરકાતે ખ્વાજા (માસિક)ના ગાહક  
બનો તથા બનાવો !! શા માટે ?!**

ઘ્યારા સુન્ની ભાઈઓ ! બરકાતે ખ્વાજા  
(માસિક) શું છે ?!

★ કુર્અન, હદીષ તથા ઉલમાએ હક્કનો પયગામ ડંકાની ચોટ  
પર અલલ એલાન આમ કરતુ માસિક એટલે.....  
બરકાતે ખ્વાજા !

★ બનાવટી બાપુઓ, શરીઅત વિરુદ્ધ ચાલતા જૂઠા પીરોની  
પોકળતાને ખુલ્લી પાડી સાચા બુજુગાને દીનના કથનો થકી  
સત્યનો પ્રકાશ વેરીને અવામને ગુમરાહીથી રોકૃતુ માસિક  
એટલે.... બરકાતે ખ્વાજા !

★ વહાબી, દેવબંદી, અહલે હદીષ, જમાઅતે ઈસ્લામી,  
નેચરી, કાદ્યાની, તમામ બાતિલ ફિર્કાઓના મજહબને  
કુર્અન, હદીષ તથા અકવાલે ઉલમા થકી ગુમરાહ સાખિત  
કરતુ માસિક એટલે બરકાતે ખ્વાજા !

★ કરન્ટ ઈસ્યુ પર, વર્તમાન મુસ્લિમ સમસ્યાઓ પર જોરદાર  
ચર્ચા કરી વાંચકોને સત્ય માર્ગ દર્શાવતુ માસિક એટલે....  
બરકાતે ખ્વાજા !

★ ઈસ્લામી સંસ્કાર (Discipline), સભ્યતાભરી શરમો  
હયાભરી તા'લીમ રજૂ કરતુ માસિક એટલે.... બરકાતે  
ખ્વાજા !

આપ પણ દીન તથા સુન્નિયતની હમદર્દીને ખાતર  
વાર્ધિક લવાજમના ઝા. ૧૦૦/- મોકલી ખુલ્લોસ  
દિલે ગ્રાહક બનો તથા બનાવો. -પ્રકાશક